



ગુજરાત જાહેર સેવા આયોગ

નાયબ સેક્શન અધિકારી વર્ગ-૩, નાયબ મામલતદાર, વર્ગ-૩ (જા.ક.:૫૫/૨૦૧૮-૧૯) ના ઉમેદવારો માટે

અગત્યની જાહેરાત

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેરાત ક્રમાંક: ૫૫/૨૦૧૮-૧૯, નાયબ સેક્શન અધિકારી, વર્ગ-૩ અને નાયબ મામલતદાર, વર્ગ-૩ ની પ્રાથમિક કસોટી તારીખ: ૧૬/૧૨/૨૦૧૮ ના રોજ લેવાનાર છે. આ જ તારીખે હાઈકોર્ટની અન્ય પરીક્ષાઓ પણ નિર્ધારિત કરેલ છે.

આ બંને પરીક્ષામાં ઉપસ્થિત રહેવા ઈચ્છનાર ઉમેદવારોની આયોગને મળેલ રજૂઆતો તથા ઉમેદવારોના હિતમાં આયોગ દ્વારા તારીખ: ૧૬/૧૨/૨૦૧૮ના રોજ યોજનાર નાયબ સેક્શન અધિકારી, વર્ગ-૩ અને નાયબ મામલતદાર, વર્ગ-૩ (જાહેરાત ક્રમાંક: ૫૫/૨૦૧૮-૧૯)ની પ્રાથમિક કસોટીનો નવો સમય બપોરના ૩:૦૦ થી ૫:૦૦ રાખવામાં આવે છે, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી.

આ બંને પરીક્ષાઓમાં નોંધાયેલ હોય તેવા ઉમેદવારો પોતાના હાઈકોર્ટની પરીક્ષાના પરીક્ષા કેન્દ્ર ખાતે પરીક્ષા આપી શકે તે માટે તેઓએ ગુજરાત હાઈકોર્ટની પરીક્ષાનું પ્રવેશપત્ર અને આયોગની નાયબ સેક્શન અધિકારી, વર્ગ-૩ની જગ્યા માટે ઓનલાઈન ભરેલ અરજીપત્રકની નકલ સહિત પોતાની અરજી તા. ૨૦/૧૧/૨૦૧૮ના રોજ સાંજના ૦૬:૧૦ વાગ્યા સુધીમાં આયોગની કચેરીમાં રૂબરૂ આપવાની રહેશે. વિકલ્પ રૂપે ઉમેદવારો પોતાની અરજી માત્ર E-mail ID: so-ex-gpsc@gujarat.gov.in પર મોકલી શકશે. પોસ્ટ દ્વારા કે અન્ય કોઈ ઈ-મેઈલ પર મોકલેલ અરજી/રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં. ઉપરોક્ત તારીખ બાદ મળેલ રજૂઆત /અરજી પણ ધ્યાને લેવામાં આવશે નહીં. તારીખ: ૧૫/૧૧/૨૦૧૮



ગુજરાત જાહેર સેવા આયોગ

અગત્યની જાહેરાત

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તા.૦૫-૦૨-૨૦૧૮ થી તા.૧૦-૦૨-૨૦૧૮ દરમિયાન યોજનાર પોલીસ ઇન્સ્પેક્ટર (બિન હથિયારધારી), વર્ગ-૨ (જા.ક.:૩૮/૨૦૧૭-૧૮) ની શારીરિક ક્ષમતા કસોટી (PET) અને શારીરિક માપ કસોટી (PST) માટે ઉપસ્થિત થનાર ઉમેદવારોની દોડ પુરી થયા બાદ કે પહેલાં મેડિકલ ચેક અપ કરવામાં આવશે અને જે કોઈ ઉમેદવાર કોઈપણ પ્રકારની નશાયુક્ત ગોળી, કેફી દ્રવ્ય કે પ્રતિબંધક દ્રવ્ય (**Energy Booster**) નું સેવન કરેલ માલૂમ પડશે તો તેમને સદરહુ જાહેરાત ઉપરાંત નિયમોનુસાર ઓછામાં ઓછા ૫ (પાંચ) વર્ષ કે આયોગ નક્કી કરે એટલા સમય માટે ગુજરાત જાહેર સેવા આયોગ ની તમામ ભરતી પ્રક્રિયા માટે ગેરલાયક ઠેરવવામાં આવશે. જેની સંબંધિત તમામ ઉમેદવારોએ નોંધ લેવી.

તા.૧૮-૦૧-૨૦૧૮